



રસાયણવિજ્ઞાન

ભાગ I

ધોરણ XII

અનુક્રમણિકા

Foreword	v
Preface	vii
એકમ-1 : ધન અવસ્થા	1
1.1 ધન અવસ્થાની સામાન્ય લાક્ષણિકતાઓ	2
1.2 અસ્ફટિકમય અને સ્ફટિકમય ધન પદાર્થો	2
1.3 સ્ફટિકમય ધન પદાર્થોનું વળીકરણ	4
1.4 સ્ફટિક લેટિસ અને એકમ કોષ	7
1.5 એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા	12
1.6 સંવૃત સંકુલિત રચનાઓ	14
1.7 સંકુલન ક્ષમતા	20
1.8 એકમ કોષ પરિમાણ સમાવિષ્ટ ગણતરીઓ	22
1.9 ધનમાં અપૂર્ણતા	24
1.10 વિદ્યુતીય ગુણધર્મો	26
1.11 ચુંબકીય ગુણધર્મો	29
એકમ-2 : દ્રાવણો	35
2.1 દ્રાવણોના પ્રકાર	35
2.2 દ્રાવણોની સાંક્રતાની અભિવ્યક્તિ	36
2.3 દ્રાવ્યતા	39
2.4 પ્રવાહી દ્રાવણોનું બાધ્યદબાણ	43
2.5 આદર્શ અને બિનઅાદર્શ દ્રાવણો	47
2.6 સંખ્યાત્મક ગુણધર્મો અને મોલરદળનું નિર્ધારણ	49
2.7 અસામાન્ય મોલરદળ	57
એકમ-3 : વિદ્યુત-રસાયણિકવિજ્ઞાન	65
3.1 વિદ્યુતરસાયણિક કોષ	66
3.2 ગેલ્વેનિક કોષ	67
3.3 નન્સ્ટ સમીકરણ	70
3.4 વિદ્યુતવિભાજયનાં દ્રાવણોની વાહકતા	75
3.5 વિદ્યુતવિભાજ્ય કોષ અને વિદ્યુતવિભાજન	85
3.6 બેટરી	88

3.7	બળતરણ કોષ	90
3.8	ક્ષારણ	91
એકમ-4 :	રાસાયણિક ગતિકી	95
4.1	રાસાયણિક પ્રક્રિયાનો વેગ	96
4.2	પ્રક્રિયા વેગને અસર કરતાં પરિબળો	100
4.3	સંકલિત વેગ સમીકરણ	105
4.4	પ્રક્રિયા વેગનો તાપમાન પર આધાર	112
4.5	રાસાયણિક પ્રક્રિયાનો સંધાત (અથડામણ) સિદ્ધાંત	116
એકમ-5 :	પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન	123
5.1	અધિશોષણ	124
5.2	ઉદ્દીપન	129
5.3	કલિલ	136
5.4	કલિલનું વર્ગીકરણ	136
5.5	પાયસ (ઈમલ્જન)	145
5.6	આપણી આસપાસ (ચોપાસ) કલિલ	145
એકમ-6 :	તત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પ્રકમો	149
6.1	ધાતુઓના પ્રાપ્તિસ્થાન	152
6.2	અયસ્કનું સંકેન્દ્રણ	153
6.3	સંકેન્દ્રિત અયસ્કમાંથી અપરિષૃત (અશુદ્ધ) ધાતુનું નિર્જર્ખણ	155
6.4	ધાતુકર્મ વિધિના ઉભાગતિય સિદ્ધાંતો	156
6.5	ધાતુકર્મ વિધિના વિદ્યુતરાસાયણિક સિદ્ધાંતો	162
6.6	ઓક્સિડેશન - રિડક્શન	163
6.7	શુદ્ધીકરણ (પરિજ્ઞરણ)	164
6.8	અલ્યુમિનિયમ, કોપર, નિક અને આર્યનના ઉપયોગો	166
એકમ-7 :	p-વિભાગનાં તત્વો	170
7.1	સમૂહ 15નાં તત્વો	170
7.2	ડાયનાઇટ્રોજન	174
7.3	એમોનિયા	175
7.4	નાઈટ્રોજનના ઓક્સાઇડ સંયોજનો	177
7.5	નાઈટ્રિક ઓસિડ	179
7.6	ફોસ્ફરસ - અપરદુપો	180
7.7	ફોસ્ફીન	181
7.8	ફોસ્ફરસ હેલાઇડ સંયોજનો	182
7.9	ફોસ્ફરસના ઓક્સોઓસિડ સંયોજનો	184

7.10	સમૂહ 16નાં તત્વો	185
7.11	ડાયઓક્સિજન	189
7.12	સાદા ઓક્સાઇડ સંયોજનો	190
7.13	ઓગ્ઝેન	191
7.14	સલ્ફર-અપરટ્રેપો	192
7.15	સલ્ફર ડાયોક્સાઇડ	193
7.16	સલ્ફરના ઓક્સોઓસિડ સંયોજનો	194
7.17	સલ્ફયુરિક ઓસિડ	195
7.18	સમૂહ 17નાં તત્વો	197
7.19	કલોરિન	202
7.20	હાઇડ્રોજન કલોરાઇડ	204
7.21	હેલોજન તત્વોના ઓક્સોઓસિડ સંયોજનો	205
7.22	આંતરહેલોજન સંયોજનો	206
7.23	સમૂહ 18નાં તત્વો	208
એકમ-8 :	<i>d</i> અને <i>f</i> વિભાગનાં તત્વો	215
8.1	આર્ટર્કોષ્ટકમાં સ્થાન	216
8.2	<i>d</i> -વિભાગનાં તત્વોની ઈલેક્ટ્રોનીય રૂચના	216
8.3	સંકાંતિ તત્વોના (<i>d</i> -વિભાગ) સામાન્ય ગુણ્ધર્મો	218
8.4	સંકાંતિ તત્વોના કેટલાક અગત્યના સંયોજનો	231
8.5	લેન્થેનોઈદ્સ	234
8.6	એક્ટિનોઈદ્સ	237
8.7	<i>d</i> અને <i>f</i> -વિભાગનાં તત્વોના કેટલાક અનુપ્રયોગો	239
એકમ-9 :	સર્વર્ગ સંયોજનો	244
9.1	સર્વર્ગ સંયોજનોનો વર્ણનો સિદ્ધાંત	244
9.2	સર્વર્ગ સંયોજનોને લગતા કેટલાક અગત્યના પર્યાયોની વાખ્યાઓ	247
9.3	સર્વર્ગ સંયોજનોનું નામકરણ	248
9.4	સર્વર્ગ સંયોજનોમાં સમઘટકતા	251
9.5	સર્વર્ગ સંયોજનોમાં બંધન	254
9.6	ધ્યતુ કાર્બોનિલમાં બંધન	261
9.7	સર્વર્ગ સંયોજનોની ઉપયોગિતા અને અનુપ્રયોગો	262
પરિશિષ્ટ		268
સ્વાધ્યાયમાંના કેટલાક પ્રશ્નોના જવાબો		281
પારિભાષિક શબ્દો		285

ગુજરાત રાજ્યના શિક્ષણવિભાગના પત્ર-કમાંક
મશબુ/1219/119-125/૭, તા. 16/02/2019 —થી મંજૂર

રસાયણવિજ્ઞાન

ભાગ II

ધોરણ XII

પ્રતિજ્ઞાપત્ર

ભારત મારો દેશ છે.
બધાં ભારતીયો મારાં ભાઈબહેન છે.
હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને
વૈવિધ્યપૂર્વી વારસાનો મને ગર્વ છે.
હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ.
હું મારાં માતાપિતા, શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ
અને દરેક જણા સાથે સભ્યતાથી વર્તીશ.
હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પું છું.
તેમનાં કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે.

કિમત : ₹ 104.00



રાષ્ટ્રીય શૈક્ષિક અનુસંધાન ઔર પ્રશિક્ષણ પરિષદ
NATIONAL COUNCIL OF EDUCATIONAL RESEARCH AND TRAINING



ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ
'વિદ્યાયન', સેક્ટર 10-એ, ગાંધીનગર-382010

રસાયણવિજ્ઞાન ભાગ Iની

અનુક્રમણિકા

એકમ 1	ઘન અવસ્થા	1
એકમ 2	દ્રાવકો	35
એકમ 3	વિદ્યુત-રસાયણવિજ્ઞાન	65
એકમ 4	રાસાયણિક ગતિકી	95
એકમ 5	પૃષ્ઠ રસાયણ	123
એકમ 6	તત્ત્વોના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પ્રકમો	149
એકમ 7	p-વિભાગનાં તત્ત્વો	170
એકમ 8	d અને f-વિભાગનાં તત્ત્વો	215
એકમ 9	સવર્ગ સંયોજનો પરિશાખ જવાબો પારિભાષિક શબ્દો	244 268 281 285

અનુક્રમણિકા

Foreword	iii
Preface	v
એકમ-10 : હેલોઆલ્કેન અને હેલોઓરિન સંયોજનો	289
10.1 વર્ગીકરણ	290
10.2 નામકરણ	291
10.3 C - X બંધનો સ્વભાવ	293
10.4 હેલોઆલ્કેન સંયોજનોની બનાવટની પદ્ધતિઓ	294
10.5 હેલોઓરિન સંયોજનોની બનાવટની પદ્ધતિઓ	296
10.6 ભૌતિક ગુણ્ધમ્મો	297
10.7 રાસાયણિક પ્રક્રિયાઓ	299
10.8 પોલિહેલોજન સંયોજનો	317
એકમ-11 : આલ્કોહોલ, ફિનોલ અને ઈથર સંયોજનો	323
11.1 વર્ગીકરણ	324
11.2 નામકરણ	325
11.3 ડિયાશીલ સમૂહોનાં બંધારણો	328
11.4 આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો	329
11.5 અૌધોગિક રીતે અગત્યના કેટલાક આલ્કોહોલ સંયોજનો	344
11.6 ઈથર સંયોજનો	345
એકમ-12 : આલ્ડિહાઇડ, કિટોન અને કાર્బોક્સિલિક ઓસિડ સંયોજનો	357
12.1 કાર્બોનિલ સંયોજનોનું નામકરણ અને બંધારણ	358
12.2 આલ્ડિહાઇડ અને કિટોન સંયોજનોની બનાવટ	361
12.3 ભૌતિક ગુણ્ધમ્મો	365
12.4 રાસાયણિક પ્રક્રિયાઓ	366
12.5 આલ્ડિહાઇડ અને કિટોન સંયોજનોના ઉપયોગો	373
12.6 કાર્બોક્સિલ સમૂહનું નામકરણ અને બંધારણ	374
12.7 કાર્બોક્સિલિક ઓસિડ સંયોજનોની બનાવટ માટેની પદ્ધતિઓ	375
12.8 ભૌતિક ગુણ્ધમ્મો	379
12.9 રાસાયણિક પ્રક્રિયાઓ	379
12.10 કાર્બોક્સિલિક ઓસિડ સંયોજનોના ઉપયોગો	384

એકમ-13 : એમાઈન સંયોજનો	389
13.1 એમાઈન સંયોજનોના બંધારણ	389
13.2 વગ્ાડીકરણ	390
13.3 નામકરણ	390
13.4 એમાઈન સંયોજનોની બનાવટ	392
13.5 ભૌતિક ગુણધર્મો	395
13.6 રાસાયણિક પ્રક્રિયાઓ	396
13.7 ડાયએજોનિયમ કારણી બનાવટ માટેની પદ્ધતિ	404
13.8 ભૌતિક ગુણધર્મો	405
13.9 રાસાયણિક પ્રક્રિયાઓ	405
13.10 એરોમેટિક સંયોજનોના સંશોધણામાં ડાયએજોનિયમ કારણી અગત્ય	406
એકમ-14 : જૈવિક અણુઓ	411
14.1 કાર્બોહાઇડ્રેટ સંયોજનો	411
14.2 પ્રોટીન સંયોજનો	420
14.3 ઉત્સેચકો	425
14.4 વિટામિન સંયોજનો	425
14.5 ન્યુક્લિક એસિડ સંયોજનો	427
14.6 અંતઃસ્ત્રાવો	430
એકમ-15 : પોલિમર	433
15.1 પોલિમરનું વગ્ાડીકરણ	433
15.2 પોલિમરાઈઝેશન પ્રક્રિયાના પ્રકાર	434
15.3 પોલિમરના આંક્વીયદળ	442
15.4 જૈવવિધટનીય પોલિમર	442
15.5 પોલિમરની વાપારિક અગત્ય	443
એકમ-16: રોજિંદા જીવનમાં રસાયણવિજ્ઞાન	447
16.1 ઓપથો અને તેમનું વગ્ાડીકરણ	447
16.2 ઓપથ-લક્ષ્ય પારસ્પરિક કિયા	448
16.3 ઓપથોના જુદા જુદા વગ્ાની થિક્ટસીય કિયા	451
16.4 ખાદ્યપદાર્થોમાં રસાયણો	457
16.5 સફાઈકર્ટો પદાર્થો	458
સ્વાધ્યાયના કેટલાંક પ્રશ્નોના ઉત્તરો	464
પારિભાષિક શબ્દો	469

ગુજરાત રાજ્યના શિક્ષણવિભાગના પત્ર-કમાંક
મશબ/1118/1565/૭, તા.02-11-2018-થી મંજૂર

પ્રયોગશાળા માર્ગદર્શિકા

રસાયણવિજ્ઞાન

ધોરણ XII

પ્રતિશ્લાપત્ર

ભારત મારો દેશ છે.

બધા ભારતીયો મારાં ભાઈ-બહેન છે.

હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને
વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે.

હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ.

હું મારા માતાપિતા, શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ
અને દરેક જગ્યા સાથે સભ્યતાથી વર્તીશ.

હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પું છું.

તેમનાં કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે.

રાજ્ય સરકારની વિનામૂલ્યે યોજના હેઠળનું પુસ્તક



રાષ્ટ્રીય શાક્ષિક અનુસંધાન ઔર પ્રશિક્ષણ પરિષદ
NATIONAL COUNCIL OF EDUCATIONAL RESEARCH AND TRAINING



ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ
'વિદ્યાયન', સેક્ટર 10-એ, ગાંધીનગર-382010

અનુક્રમણિકા

Foreword Preface

iii

v

એકમ - 1 : કલિલ

- (a) દ્વારાનુરાગી અને (b) દ્વારાવિરાગી સોલ બનાવવા
- બનાવેલા સોલને પારશ્વેષણ વડે શુદ્ધ કરવું
- જુદા જુદા તેલના પાયસોના સ્થાયીકરણમાં પાયસીકારકોના ફાળાનો (role) અભ્યાસ કરવો.

1

1

4

5

એકમ - 2 : રાસાયણિક ગતિકી

- સોડિયમ થાયોસલ્ફેટ અને હાઈડ્રોક્લોરિક ઓસિડ વચ્ચેની પ્રક્રિયાના વેગ (d) પર અનુક્રમે સાંક્રતા અને તાપમાનના ફેરફારની અસરનો અભ્યાસ કરવો.
- ઓરડાના તાપમાને આયોડાઇડ આયન અને હાઈડ્રોજન પેરોક્સાઇડ વચ્ચેની પ્રક્રિયાના વેગ પર આયોડાઇડ આયનની સાંક્રતામાં ફેરફારની અસરનો અભ્યાસ કરવો.
- પોટોશિયમ આયોડિટ (KIO_3) અને સોડિયમ સલ્ફાઇટ (Na_2SO_3) વચ્ચેની પ્રક્રિયાના પ્રક્રિયા-વેગનો અભ્યાસ કરવો.

8

8

12

15

એકમ - 3 : ઉભારાસાયણિક માપન

- કોપર સલ્ફેટ/પોટોશિયમ નાઈટ્રેટની વિલયન એન્થાલ્પી નક્કી કરવી.
- પ્રબળ ઓસિડની (HCl) પ્રબળ બેઇઝ ($NaOH$) સાથેના તટરથીકરણની એન્થાલ્પી નક્કી કરવી.
- ઓસિટોન અને કલોરોફોર્મ વચ્ચેની (હાઈડ્રોજનબંધ રચના) પારસ્પરિક કિયા માટે એન્થાલ્પી ફેરફાર નક્કી કરવો.

19

20

24

26

એકમ - 4 : વિદ્યુતરસાયણવિજ્ઞાન

30

- $Zn/Zn^{2+} || Cu^{2+}/Cu$ કોષનો વિદ્યુત વિભાજ્ય ($CuSO_4/ZnSO_4$)ની સાંક્રતામાં ફેરફાર સાથે કોષ પોટોનિયલનો ઓરડાના તાપમાને અભ્યાસ કરવો.

31

એકમ - 5 : વર્ણાલેખિકી (કોમેટોગ્રાફી)	34
● પાલકની ભાજના પાંડાંમાં રહેલા અને ગુલાબના ફૂલની પાંખરીમાં રહેલા તથા હજારીગલમાં રહેલા રંજકોનું પેપર કોમેટોગ્રાફી વડે અલ્વિગકરણ અને ઘટકોનાં R_f મૂલ્યોનું નિર્ધારણ કરવું.	34
● કોમેટોગ્રાફિક પ્રવિધિનો ઉપયોગ કરીને Pb^{2+} અને Cd^{2+} બે ધનાયનો ધરાવતા અકાર્બનિક સંયોજનોના મિશ્રણના ઘટકોનું અલગીકરણ.	37
એકમ - 6 : અનુમાપનીય પૃથક્કરણ (રેઝોક્ષ પ્રક્રિયાઓ)	40
● $KMnO_4$ ના દ્રાવણની સાંદ્રતા/મોલારિટી, ઓક્ઝિલિક ઓસિડના 0.1 M પ્રમાણિત દ્રાવણ સાથે અનુમાપન કરીને નક્કી કરવી.	40
● $KMnO_4$ દ્રાવણની સાંદ્રતા/મોલારિટી, પ્રમાણિત ફેરસ એમોનિયમ સલ્ફેટના દ્રાવણ સાથેના અનુમાપનથી નક્કી કરવી.	45
એકમ - 7 : પદ્ધતિસર ગુણાત્મક પૃથક્કરણ	49
● આપેલા કારમાં રહેલા એક ધનાયન અને એક ઋણાયનની પરખ કરવી.	50
● ઋણાયનોનું પદ્ધતિસર પૃથક્કરણ	51
● મંદ સલ્ફ્યુરિક ઓસિડ સાથેની પ્રાથમિક કસોટી	51
● મંદ સલ્ફ્યુરિક ઓસિડ સાથેની ઋણાયનોની નિર્ણાયક કસોટી	52
● સાંદ્ર સલ્ફ્યુરિક ઓસિડ સાથેની પ્રાથમિક કસોટી	56
● સાંદ્ર સલ્ફ્યુરિક ઓસિડ સાથે ઋણાયનોની નિર્ણાયક કસોટીઓ	57
● સલ્ફેટ અને ફોસ્ફેટની કસોટીઓ	62
● ધનાયનોનું પદ્ધતિસર પૃથક્કરણ	63
● ધનાયનોની પરખ માટેનું ક્ષારનું પ્રાથમિક પરીક્ષણ	63
● ધનાયનોની પરખ માટેની ભીની કસોટીઓ	69
● શૂચ સમૂહ ધનાયનોનું પૃથક્કરણ	69
● સમૂહ-Iના ધનાયનોનું પૃથક્કરણ	71
● સમૂહ-IIના ધનાયનોનું પૃથક્કરણ	72
● સમૂહ-IIIના ધનાયનોનું પૃથક્કરણ	75
● સમૂહ-IVના ધનાયનોનું પૃથક્કરણ	76
● સમૂહ-Vના ધનાયનોનું પૃથક્કરણ	79
● સમૂહ-VIના ધનાયનોનું પૃથક્કરણ	81
● ક્ષારના પૃથક્કરણ માટે નમૂનાની નોંધ	84

એકમ - 8 : કાર્બનિક સંયોજનોમાં કિયાશીલ સમૂહો માટેની કસોટીઓ	86
● અસંતૃપ્તતા માટેની કસોટીઓ	86
● આલ્કોહોલિય સમૂહની કસોટીઓ	88
● ફિનોલિક સમૂહની કસોટીઓ	90
● આલ્ડિહાઇડ અને કિટોન સમૂહની કસોટીઓ	92
● કાર્બોક્સિલ સમૂહની કસોટીઓ	95
● એમિનો સમૂહની કસોટીઓ	97
એકમ - 9 : અકાર્બનિક સંયોજનોની બનાવટ	100
● દ્વિક્ષાર સંયોજનો બનાવવા : ફેરસ એમોનિયમ સલ્ફેટ (મોઝર કાર) અને પોટાશ એલમ	100
● પોટોશિયમ ટ્રાયઓક્લેલેટોફ્રેટ (III) બનાવવો.	102
એકમ - 10 : કાર્બનિક સંયોજનોની બનાવટ	104
● એસિટેનિલાઇડ બનાવવો	104
● ડાયબેન્જાલ એસિટોન (ડાયબેન્જાઈલિડીન એસિટોન) બનાવવો.	106
● p - નાઇટ્રોએસિટેનિલાઇડ બનાવવો.	107
● ફિનાઈલ-એઝો - β - નેથોલ (એઝોરંગક) બનાવવો.	109
● એનિલીન પીળો (p - એમિનોએઝોબેન્જિન) બનાવવો.	111
એકમ - 11 : કાર્બોહાઇડ્રેટ, ચરબી અને પ્રોટીન સંયોજનોની કસોટીઓ	114
● કાર્બોહાઇડ્રેટ સંયોજનો માટે કસોટીઓ	114
● તૈલી પદાર્થો અને ચરબીયુક્ત પદાર્થો માટે કસોટી	120
● પ્રોટીન સંયોજનો માટે કસોટીઓ	121
પરિયોજનાઓ	125
પરિશિષ્ટ	132